

પિસ્ટલ તથા જીવતા કાર્ટીઝ સાથે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને ઝડપી પાડતી,

સુરત શહેર કાઇમ બ્રાંચ.

સુરત શહેર વિસ્તારમાં શહેરમાં કોઈ અનીચ્છનીય બનાવ ના બને તે હેતુથી હથીયારો સાથે રાખી ફરતા ઈસમોને ઝડપી પાડવા અનુસંધાને પો.સ.ઈ. સી.આર.દેસાઈ નાઓની ટીમ આ સંદર્ભે વર્ક આઉટમાં હતી. દરમ્યાન હે.કો.મનોજ તુકારામ અને હે.કો. શૈલેષ રાઘેબિહારી નાઓને બાતમી મળેલ કે હિરો સ્પ્લેન્ડર મો.સા. નં.GJ-05-PN-1021 ઉપર ગંભીર ગુનામાં નાસતો-ફરતો કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તેના મિત્ર સાથે જોળવા બાજુ ગયેલ છે. જે હક્કીકત આધારે તપાસ કરવા જતા સાંકી ગામ બગુમરા સાંકીરોડ તા.પલસાણા જી.સુરત. ખાતે પહોંચતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેનો મિત્ર પોલીસ માણસોને જોઈ જતા પોતાની મો.સા. પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારીને ભાગવા જતા મો.સા.સ્લીપ થઈ જતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર તથા તેના મિત્રને શરીરે ઈજા થયેલ હતી. જે બાબતે પલસાણા પો.સ્ટે.માં અલગથી ગુનો રજીસ્ટર થયેલ. મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરને આજ રોજ ખાનગી હોસ્પિટલમાંથી રજા આપતા પોલીસ સ્ટેશન ખાતે લાવી પુછપરછ કરતા કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરે દેશી હાથ બનાવટની પિસ્ટલ પોતાના મિત્ર સોપાનદેવ ઉર્ફે સાગર s/o સખારામ પાટીલના ઘરે છુપાવેલ હોવાની હકીકત જણાવતા જે આધારે પિસ્ટલ નંગ-૧ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા જીવતા કાર્ટીઝ નંગ-૦૬ કિ.રૂ.૬૦૦/- કુલે કિ.રૂ.૧૫,૬૦૦/- ની મત્તાના મુદ્દામાલ હથીયાર મેળવી મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર વિરૂધ્ધ ડી.સી.બી. પો.સ્ટે. 11-૧૬૦/૨૦૧૯ આર્મ્સ એક્ટ કલમ. ૨૫(૧)(A) મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરના ભાઈની હત્યા સમાધાન રાજપુત તથા કોમલસિંગ ગીરાશેએ કરેલ હોઈ તેઓની સાથે વેરભાવ હોઈ તેના ભાઈની હત્યાનો બદલો લેવા પોતે હથીયાર સાથે રાખી ફરતો હોવાની હકીકત જણાવેલ છે. મજકુર કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોરની વધુ પુછપરછ કરતા મજકુરે સુરત શહેરમાં અલગ અલગ જગ્યાએ ચેઈન સ્નેચીંગ તથા બેંગ લીફ્ટીંગ કરેલ હોવાની કબુલાત કરેલ. આ ઉપરાંત મજકુર ખુન, ખુનની કોશીષ, અપહરણ તથા મારામારીના ગુનામાં નાસતા ફરતો હોય જે નીચે મુજબના વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

ગુનાઓ ડીટેક્ટ થયેલ છે.

(૧) પુણા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૪૭૪/૨૦૧૯ ઈ.પી.કો. કલમ-૩૭૯(એ),૧૧૪ (ચેઈન સ્નેચીંગ)(૨) સલાબતપુરા પો.સ્ટે. 1 ગુ.ર.નં. ૪૩૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ.૩૭૯(એ)૩,૧૧૪ (ચેઈન સ્નેચીંગ)(૩) સલાબતપુરા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૪૯૧/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)૩,૧૧૪. (બેંગ લીફ્ટીંગ) (૪) લીંબાયત પો.સ્ટે. 1 ગુ.ર.નં.૨૧૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ),૧૧૪ મુજબ (ચેઈન સ્નેચીંગ)(૫) લીંબાયત પો.સ્ટે. 1 ગુ.ર.નં.૩૬૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯(એ)૩,૧૧૪ મુજબ (ચેઈન સ્નેચીંગ)(૬) લીંબાયત પો.સ્ટે. 1 ગુ.ર.નં.૩૪૬/૨૦૧૯ ઈ.પી.કો. કલમ.૩૭૯(એ)૩, ૧૧૪ મુજબ (ચેઈન સ્નેચીંગ)(૭) પાંડેસરા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૩૨૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૭૯ (વાહન ચોરી)

નીચેના ગુનાઓમાં નાસતો- ફરતો:-

(૧)ઉમરા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૨૨૫/૨૦૧૯ ઈ.પી.કો.કલમ-૩૬૫,૩૦૨,૧૧૪ (અપહરણ કરી હત્યા)(૨) લીંબાયત પો.સ્ટે. 1 ગુ.ર.નં. ૨૨૦/૨૦૧૯ ઈ.પી.કો. કલમ- ૩૦૭,૩૪,૧૨૦(બી), તથા આર્મ્સ એક્ટની કલમ-૨૫(૧)(એ), ૨૭(૧) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫(૧) (ફાયર આર્મ્સ સાથે હત્યાની કોશીષ)(૩) પુણા પો.સ્ટે. 1 ગુ.ર.નં.૨૯૨/૧૯ ઈ.પી.કો. ૩૯૨,૩૯૭, ૧૧૪ તથા આર્મ્સ એક્ટ ૨૫(૧) (ફાયર આર્મ્સ સાથે લુટ) (૪)લીંબાયત પો.સ્ટે. 1 ગુ.ર.નં.૨૩૮/૨૦૧૯ ઈ.પી.કો. ૩૯૨, ૩૯૪, ૩૯૭,૫૦૬(૨),૧૧૪ (ગંભીર ઈજા પહોંચાડી લુટ)(૫) ખટોદાર પો.સ્ટે. 1 ગુ.ર.નં.૨૫૪/૨૦૧૯ ઈ.પી.કો. કલમ- ૩૯૫, ૩૯૭,૧૧૪ (ધાડ) (૬)લીંબાયત પો.સ્ટે. 11 ગુ.ર.નં.૮૧૯/૨૦૧૯ ઈ.પી.કો.૩૨૩,૨૯૪(ખ),૫૦૬(૨), ૧૧૪ જી.પી. એક્ટ કલમ- ૧૩૫ (મારામારી).